



સીટી ઓફ બ્રેમ્પટને મેન્ડેટરી માસ્ક બાય-લો ઉઠાવીને ધીમે ધીમે અને સુરક્ષિતપણે રિઓપન કરવાનું ચાલુ રાખ્યું છે

બ્રેમ્પટન, ઓન્ટેરિયો (માર્ચ 18, 2022) – કર્મચારીઓ ઓફિસ અને સીટીના કામકાજના સ્થળો પર ધીમે ધીમે અને સુરક્ષિતપણે પરત આવી રહ્યાં છે ત્યારે, સીટી ઓફ બ્રેમ્પટને આરોગ્ય અને સુરક્ષા પર ધ્યાન આપીને રિઓપન કરવાનું ચાલુ રાખ્યું છે.

મેન્ડેટરી માસ્ક બાય-લો

સીટીએ સોમવાર, માર્ચ 21, 2022 નાં રોજ સમાપ્ત થતા પોતાના [બ્રેમ્પટન COVID-19 મેન્ડેટરી માસ્ક બાય-લો](#)માં સુધારો કર્યો છે. આ પ્રોવિન્સ ઓફ ઓન્ટેરિયોની આ જ તારીખે મોટા ભાગના સ્થળોએ પ્રોવિન્સની માસ્ક પહેરવાની જરૂરિયાતો ઉઠાવી લેવાને અનુરૂપ છે.

માસ્ક્સ પહેરવાની જરૂરિયાત પબ્લિક ટ્રાન્ઝિટ અને ઈનડોર ટર્મિનલ્સ, આરોગ્ય સંભાળના સ્થળો, લાંબા-ગાળાની સંભાળ લેતા ગૃહો અને સામૂહિક સંભાળ સ્થળો જેવા પસંદગીના સ્થળોમાં ચાલુ રહેશે. હવે પછી માસ્ક્સ પહેરવા બિલકુલ જરૂરી ના હોય તેવા સ્થળોએ માસ્ક્સ પહેરવાનું ચાલુ રાખતા લોકોનો આદર કરવાનું રહેવાસીઓને કહેવામાં આવે છે.

મેન્ડેટરી ફેસ માસ્ક બાય-લો હેઠળ, બધાં ઈનડોર જાહેર સ્થળોમાં મેડિકલ-સિવાયના માસ્ક્સની જરૂર પડતી હતી જેથી સમુદાયનું આરોગ્ય અને સુરક્ષાનું સંરક્ષણ કરી શકાય. તે સુધારો અમલી બને તે પહેલાં એપ્રિલ 1, 2022 નાં રોજ સમાપ્ત થવાનું નિર્ધારિત હતું.

બ્રેમ્પટન ટ્રાન્ઝિટ

બ્રેમ્પટન ટ્રાન્ઝિટની બધી બસોમાં અને બ્રેમ્પટન ટ્રાન્ઝિટ ટર્મિનલ્સમાં [પ્રોવિન્સના નિયમનો](#) અનુસાર માસ્ક્સ પહેરવાનું ચાલુ રહેશે. સફાઈ અને સેનિટાઈઝિંગ અમલમાં રહે છે, અને સગવડો અને ટર્મિનલ્સ જેની સપાટીઓ સખત હોય તે રોજિંદા ધોરણે સાફ કરીને સેનિટાઈઝ કરવામાં આવે છે.

વેબસાઈટ www.bramptontransit.com જુઓ અથવા [@bramptontransit](https://twitter.com/bramptontransit) ને Twitter પર અનુસરો. કોઈપણ પ્રશ્નો સીધા બ્રેમ્પટન ટ્રાન્ઝિટના સંપર્ક કેન્દ્રને 905.874.2999 નંબર પર પૂછી શકાય છે.

મનોરંજન

માર્ચ 21 થી શરૂ કરીને, સીટી રિક્રિએશન સેન્ટર્સમાં પ્રવેશતા લોકોએ હવે પછી માસ્ક પહેરવાની જરૂર નથી. રિક્રિએશન સગવડોનો ઉપયોગ કરતી વખતે માસ્ક પહેરવાનું ચાલુ રાખવા ઈચ્છતા લોકોને તેમ કરવાની છૂટ છે.

રિક્રિએશન સેન્ટર્સમાં ક્ષમતા સીમાઓ અને રસીકરણનો પુરાવો રાખવાની જરૂરિયાતો તાજેતરમાં ઉઠાવી લેવાઈ રહેલાં પ્રોવિન્સના નિયમનોને અનુરૂપ કાઢી નાખવામાં આવી છે. રિક્રિએશન સેન્ટર્સ નોંધાયેલા મુલાકાતીઓ અને ડ્રોપ-ઈન (નોંધણી વગર પણ આવી શકાય તેવા) કાર્યક્રમો માટે ખુલ્લા રહે છે. રિક્રિએશન સેન્ટર્સની મુલાકાતો માટે પહેલેથી નોંધણી જરૂરી નથી, જોકે, બધી સેવાઓ વહેલો તે પહેલો ધોરણે અપાતી હોવાને લીધે મુલાકાતીઓ મુલાકાત લેતા પહેલાં પોતાની સર્વિસ અગાઉથી ઓનલાઈન ખરીદે તેવી ભલામણ કરવામાં આવે છે.



311 નંબરને કોલ કરીને, અથવા કોઈ સીટી રિક્રિએશન સેન્ટરમાં રૂબરૂમાં ઉપલબ્ધ કાર્યક્રમો જુઓ અને વેબસાઈટ www.brampton.ca/registerforprograms પર નોંધણી કરાવો.

પ્રતિનિધિ મંડળો

સીટીની બધી બેઠકો માટે પ્રતિનિધિ મંડળો બુધવાર, માર્ચ 30, 2022 સુધી દૂરસ્થ (રિમોટ) રહેશે. માર્ચ 30 પછી, દૂરસ્થ સહભાગિતા હજુ પણ ઉપલબ્ધ રહેવાની સાથે, રૂબરૂ પ્રતિનિધિ મંડળોની પરવાનગી આપવામાં આવશે.

સીટીનું આગામી બેઠક સમયપત્રક [અહીં](#) જોઈ શકાય છે.

COVID-19 તપાસ

હવે પછી રિક્રિએશન સગવડો સહિતની, સીટીની સગવડોમાં પ્રવેશવા પ્રી-સ્ક્રીનિંગ (તપાસ-પહેલાંની મુલાકાત)ની બિલકુલ જરૂર પડતી નથી. રહેવાસીઓને ઘરે રહેવાનું ચાલુ રાખવાનું પ્રોત્સાહન આપવામાં આવે છે જો તેઓ અસ્વસ્થ અનુભવે.

રહેવાસીઓએ સમગ્ર મહામારી દરમિયાન ફેલાવો રોકવામાં મદદ મેળવવા વ્યક્તિઓ વચ્ચે શારીરિક અંતર જાળવીને, સારા સ્વચ્છતાશાસ્ત્રનો મહાવરો કરીને અને માસ્ક્સ પહેરવાનું ચાલુ રાખીને પોતાનો ભાગ ભજવ્યો તે બદલ સીટી રહેવાસીઓનો આભાર માને છે. રહેવાસીઓએ ઘરે રહીને, અને COVID-19 વિરોધી રસી અને બૂસ્ટર મૂકાવીને સમુદાયના આરોગ્ય અને સુરક્ષાને પહેલી પ્રાથમિકતા આપવાનું ચાલુ રાખવું જોઈએ. COVID-19 રસીકરણ પર સૌથી અદ્યતન માહિતી માટે, પ્રોવિન્સનું [વેક્સિન પોર્ટલ](#) જુઓ.

-30-

મીડિયા સંપર્ક (MEDIA CONTACT)

સીટી ઓફ બ્રમ્પટન મલ્ટીકલ્ચરલ મીડિયા

multiculturalmedia@brampton.ca